

**Proactive Disclosure of Vadodara Smartcity Development Ltd.**

(૧) સંસ્થા, કામગીરીઓ અને ફરજોની વિગતો:

કામગીરીઓ/ફરજો :

સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં વડોદરા શહેરની પસંદગી ત્રીજા રાઉન્ડમાં કરવામાં આવેલ હતી. જેમાં ૨૩૯૭.૫૭ કરોડના કુલ ૫૭ પ્રોજેક્ટ લેવામાં આવ્યા હતા. જેમાં PPP, Convergence તથા સ્માર્ટસીટી ફંડના પ્રોજેક્ટ સામેલ છે. હાલના તબક્કે તમામ પ્રોજેક્ટ DPR Stage થી આગળ વધી ચુક્યા છે. જેમાં ૨૭ પ્રોજેક્ટ થઈ ચુક્યા છે, ૨૨ પ્રગતિ હેઠળના છે, તથા ૪ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.

વડોદરા સ્માર્ટસીટી ડેવલપમેન્ટ લીમીટેડ અંતર્ગત કુલ ૨૩૯૭.૯૭ કરોડના પ્રોજેક્ટ PPP Convergence અને સ્માર્ટસીટી ફંડ અંતર્ગત કાર્યરત છે .જેમાં PPP પ્રોજેક્ટ ૧૦૫૪.૦૩ કરોડના Convergence પ્રોજેક્ટ ૩૬૭.૫૪ કરોડના અને સ્માર્ટસીટી પ્રોજેક્ટ ૯૭૬ કરોડના સામેલ કરવામાં આવેલ છે. જેમાં સ્માર્ટસીટીના ૯૭૬ કરોડના કેન્દ્ર સરકારનો ૫૦% ફાળો તેમજ રાજ્ય સરકારનો ૨૫% ફાળો અને વડોદરા મહાનગરપાલિકાનો ૨૫% ફાળો ભાગરૂપે રાખેલ છે.

(૨) પોતાના અધિકારી અને કર્મચારીઓની સત્તાઓ તથા ફરજો:

- અધિકારી /કર્મચારીઓના નામ, હોદ્દો, પગાર તથા કામગીરીની વિગત.

અનુ.	નામ	હોદ્દો, બેઝીક પગાર (ઉચ્ચક માસિક) (૩ વર્ષ કોન્ટ્રાક્ટ)	કામની વિગત
૧.	કાજલ જયસ્વાલ	<b>Chief Financial Officer</b> (₹૭૦,૦૦૦)	<b>Finance</b> ને લગતી કામગીરી.
૨.	વિમલ બેતાઇ	<b>Company Secretary</b> (₹૬૦,૦૦૦)	<b>Legal company norms/ AOA, MOA</b> તથા <b>Legal</b> લગતી કામગીરી.
૩.	જનક જોશી	<b>GIS Specialist</b> (₹૫૫,૦૦૦)	<b>Geographical Information System</b> તથા <b>Day to Day geographical collection</b> ને લાગતી કામગીરી.
૪.	અશ્વિની મુદાલિયાર	<b>GIS Expert</b> (₹૫૫,૦૦૦)	<b>GIS based proper survey</b> તથા <b>Layer</b> ને લાગતી કામગીરી.

૫.	શિવાંગી શાહ	<b>SCADA Specialist</b> (₹૪૫,૦૦૦)	<b>Water SCADA</b> ને લગતી કામગીરી.
૬.	પ્રિયાંક શાહ	<b>Architect</b> (₹૭૦,૦૦૦)	<b>Infrastructure</b> ના <b>Project</b> અંતર્ગત <b>Architect</b> હેઠળ આવતી કામગીરી.
૭.	હીના ચૌધરી	<b>HR Executive</b> (₹૧૫,૦૦૦)	<b>Employees</b> ના <b>HR related</b> કામગીરી.
૮.	વૈભવી કોટરીયા	<b>Account Executive</b> (₹૨૦,૦૦૦)	<b>Chief Financial Officer</b> ની <b>under</b> મા કામગીરી.
૯.	નિલમ યાદવ	<b>Statistical Assistant</b> (₹૧૫,૦૦૦)	<b>Data Analysis</b> ની કામગીરી.
૧૦	પ્રિયંકા ચારપોટ	<b>Supervisor</b> (₹૧૭,૫૦૦)	<b>Report</b> તથા કેમેરા અને બીજા <b>IOT device</b> ની કામગીરી.
૧૧	અશોક પટેલ	<b>Programmer</b> (₹૩૩,૦૦૦)	<b>Software Integration</b> ની કામગીરી.
૧૨	હર્ષાલિ ભગત	<b>Programmer</b> (₹.૧૦,૦૦૦)	<b>Software Integration</b> પ્રોગ્રામ ને મેનેજ અને મેન્ટેન કરવા આસીસ્ટ કરવું.
૧૩	પ્રિયા પટેલ	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૪	શિલપા કાપડિયા	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing માટેની કામગીરી.
૧૫	હિમાંશુ ધોબી	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૬	મિતુલ સરવૈયા	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૭	સુરેશ પરમાર	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૮	વિશાલ ગોહિલ	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૧૯	ધવલ મકવાના	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૨૦	ચિરાગ પટેલ	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૨૧	હિમિલ પટેલ	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૨૨	મિતેશ ગોહિલ	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.

૨૩	દિપિકા શિશોદિયા	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૨૪	હાર્દીક રબારી	<b>Help Desk Executive</b> (₹.૧૩,૦૦૦)	દરેક કેમેરા તથા device maintaining & managing ની કામગીરી.
૨૫	રોનક જે. શાહ	<b>Network Administrator</b> (₹.૪૦,૧૫૦)	Managing & Maintaining Network, Server, and Hardware Of VMC and VSCDL
૨૬	રાજેશ મિસ્ત્રી	<b>Network Administrator</b> (₹.૩૩,૦૦૦)	Managing & Maintaining Network, Server, and Hardware Of VMC and VSCDL

### અધિકારી /કર્મચારીઓના નામ, હોદ્દો, પગાર તથા કામગીરીની વિગત.

અનુ.	નામ	નોકરી નો સમયગાળો	હોદ્દો, બેઝીક પગાર (ઉચ્ચક માસિક)	કામની વિગત
૧	રાજેન્દ્ર શાહ	(૧ વર્ષ કોન્ટ્રાક્ટ)	Heritage Expert (₹.૨૦,૦૦૦)	Heritage ને લગતી કામગીરી
૨	બેલા ભટ્ટ	(૧૧ માસના કરાર પર)	Junior Assistant Heritage (₹.૧૦,૦૦૦)	Heritage ને લગતી કામગીરી
૩.	મોહન પટેલ	(Daily Wage )	Heritage Assistant (₹.૩૪૦.૫ Per Day)	Heritage ને લગતી કામગીરી

૩) નિરિક્ષણ અને જવાબદારીના સાધનો સહીત નિર્ણય લેવાની પ્રક્રિયા સમક્ષ મંજૂરી મેળવતી વખતે મુખ્યત્વે નીચે પ્રમાણે કાર્ય પધ્ધતિ હાથ ધરવામાં આવે છે. સંબંધિત દફતરના સ્ટાફ દ્વારા કચેરીના CFO/CS ની સમક્ષ ફાઇલ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર નિર્ણય લેવાની જવાબદારી CEO VSCDL ની હોય છે.

૪) પોતાના કાર્યો બજાવવા માટે નકકી કરાયેલા ધોરણો :

વિભાગ મા રોજ-બરોજ ના કાર્યો પાર પાડવા MOUD, Delhi, Smart city guidelines અનુસાર કાર્યો કરવા ના હોય છે. આ ઉપરાંત સરકાર શ્રી દ્વારા સમયે સમયે બહાર પાડવામાં આવતી મૌખિક / લેખિત સુચનાઓ/ આદેશો નું અમલિકરણ રોજીંદી ફરજો બજાવવા માટે કરવામાં આવે છે.

પ) પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો સૂચનાઓ નિયમ સંગ્રહો અને રેકોર્ડ:

વિભાગની મુખ્ય કામગીરી Approval projects પર કાચે કરવા ની રહે છે. આ કામગીરી સ્માટેસીટી ગાઈડ લાઇન અનુસાર કરવામાં આવે છે.

ડ) પોતાના દ્વારા અથવા અંકુશ હેઠળ રખાયેલ વિવિધ કેટેગરીના દસ્તાવેજોનું નિવેદન : કચેરીઓની કાર્યપદ્ધતિમાં મૂળભૂત રજીસ્ટરો જેવાકે ઇનવેડ, આઉટવેડ રજીસ્ટર અને રીસિપ્ટ બીલ રજીસ્ટર તેમજ પેમેન્ટ રજીસ્ટરની નિભાવની કરવામાં આવે છે.

૭) તેની નીતિ ઘડવાના અથવા તેના અમલીકરણ સંબંધિત જાહેર જનતાના સભ્યો દ્વારા રજુઆત કરાયેલી અથવા તેની ચર્ચા માટે રહેલી કોઇપણ પ્રકારની વ્યવસ્થાની વિગતો : તેની નીતિ ઘડવાના અથવા તેના અમલીકરણ માટે કંપની ના Article Of Association નિયમો મુજબ કરવા માં આવે છે.

૮) પોતાના ચલણના હેતુ માટે અથવા તેના ભાગ તરીકે રચાયેલી બે કે તેથી વધુ વ્યક્તિઓ ધરાવતાં બોર્ડસ, કાઉન્સિલ કમિટીઓ અને અન્ય મંડળોનું નિવેદન અને બોર્ડસ કાઉન્સિલ કમિટીઓ અને અન્ય મંડળોની બેઠકો જાહેર પ્રજા માટે ખુલ્લી છે કે કેમ ? અથવા આવી બેઠકની વિગતો જાહેર પ્રજા મેળવી શકે કે કેમ ?

પોતાના ચલણના હેતુ માટે અથવા તેના ભાગ તરીકે રચાયેલી બે કે તેથી વધુ વ્યક્તિઓ ધરાવતાં બોર્ડસ, કાઉન્સિલ કમિટીઓ અને અન્ય મંડળોનું નિવેદન અને બોર્ડસ કાઉન્સિલ કમિટીઓ અને અન્ય મંડળોની બેઠકો જાહેર પ્રજા માટે ખુલ્લી નથી.

૯) પોતાના આધિકારીઓ અને કર્મચારીઓની ડીરેક્ટરી :

મુદ્દા નંબર ૨ માં સમાયેલી યાદી મુજબ.

૧૦) તેના નિયમમાં પુરી પડાયેલ પડતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલ માસિક પગાર :

માસિક પગાર અંગેની વિગત મુદ્દા નં.૨ ના લીસ્ટમાં આવરી લેવામાં આવેલ છે.

૧૧) તમામ યોજનાઓ ની વિગતો , સુચિત ખર્ચાઓ અને કરાયેલ ચુકવણીના અહેવાલો દર્શાવતા તેની તમામ એજન્સીને ફાળવેલ બજેટ :

જે તે નાણાકીય વર્ષ માટેના મંજુર થયેલ બજેટ અને એપુલ્ક સ્ટેસ્યુટરી ઓડીટ રીપોર્ટસ

૧૨) ફાળવાયેલી રકમ અને આ કાર્યક્રમોથી ફાયદો મેળવનારની વિગતો સહિત સબસીડી સહિત કાર્યક્રમોનો અમલનો પ્રકાર :

લાભાર્થીઓને લગતી માહિતી કચેરીને લાગુ પડતી નથી.

૧૩) તેના દ્વારા અપાયેલી છુટછાટો, પરવાનગીઓ અને સત્તા સોંપણી મેળવનારની વિગતો:

સ્માર્ટસીટી ડીપાર્ટમેન્ટ દ્વારા કોઈ છુટછાટો પરવાનગીઓ કે અધિકૃતકરણ કરવામાં આવતું નથી.

૧૪) ઇલેક્ટ્રોનિક્સ ફોર્મ્સમાં ઘડાયેલી તેના દ્વારા રાખયેલી અથવા તેને ઉપલબ્ધ માહિતીના સંદર્ભની વિગતો :

વડોદરા સ્માર્ટસીટી અંતર્ગત કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ફોર્મ વેબસાઇટ પર રાખવામાં આવે છે.

“www.vadodarasmartcity.in”

૧૫) પુસ્તકાલય અથવા વાંચનખંડના કામના કલાકો સહિત માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો, જો જાહેર ઉપયોગ માટે તેની જાળવણી કરાઈ હોય તો :

શાખામાં પુસ્તકાલય અથવા વાંચનખંડ ઉપલબ્ધ નથી.

૧૬) જાહેર માહિતી / અપીલ અધિકારીઓના નામ, હોદ્દો અને અન્ય વિગતો :

(1) જાહેર માહિતી અધિકારી

હીના ચૌધરી

HR EXECUTIVE (VSCDL)

મો-૬૩૫૯૬૪૩૭૮૦

(2) અપીલ અધિકારી

કાજલ જયસ્વાલ

C.F.O (VSCDL)

મો- ૬૩૫૯૬૪૩૭૭૮

૧૭) સૂચવી શકાય તેવી અન્ય કોઈ માહિતી અને ત્યારબાદ દર વર્ષે આ પ્રકાશનમાં સુધારા કરાશે.

કામો સંબંધિત માહિતી મંજુર થયેલ બજેટ ને અનુલક્ષી ને આવી જાય છે.